

खास्थयमा सर्वत्यापी पहुँच : चुनौती र अवसर



डॉ. कर्तिकदत्त मिश्र

अगले विश्वत्यापी रुपमा अधि बदाइएको दिनो विकास लक्ष्यमा विकास लाई नायर्केन्द्र अवागमनाभन्नकाम विशेष जोड दिएर समावेश गरिएको पाइन्छ । यसले आकृना नायरहरूलाई सुमति अंडिकारमूली विकासको कर्ताको दावगाहाट होइको पाइ पाइ तुन्छ । साथै, यसले आग्रामभूत मानवीय आवश्यकता, जस्तै खोकमी तथा नायरीको अन्य, सौमिक लागि सुरक्षित चालेपारी र मरसफाइ दृष्टि रूपमा भूमि उभयन सम्बन्धका व्यापकहरूका लागि स्वास्थ जीवन सुनिश्चित गर्दै समृद्ध जीवन प्रवर्द्धन गर्ने महावाक्याङ्की लाय राखेको छ ।

नुस्खारीय स्वास्थ्य सेवामा सौमिक सर्वसमूह पहुँच सुनिश्चित रानु रायको महाविषय दायित्व हो । नेपालको सूक्षिकानको छाना प्र० (१) र (२) मा जातेक नागरिकलाई राज्यबाट आग्रामभूत स्वास्थ्य सेवा नियुक्त प्राप्त गर्ने हक र कर्मीलाई चलि आकस्मिक स्वास्थ्य सेवाबाट विकल्प नयाँने तथा जातेक नागरिकलाई स्वास्थ्य सेवामा सामान पहुँचको हक सुनिश्चित गर्ने कुरा प्राप्त गरिएको छ । स्वास्थ्यमा वस्तो सर्वत्यापी पहुँच सुनिश्चित रानु रायको नायरहरूलाई विभिन्न नीतिका प्रयोगहरू भएका छन् । गणित्य स्वास्थ्य नीति-वि.सं. २०५५, नन्ही वोजाना (वि.सं. २०५५, ३३-२०८० /८१), नेतृत्व स्वास्थ्य लेत्र रजनीति (वि.सं. २०५२-२०५३), दिनो विकास लाय (वि.सं. २०५५-२०८०) र लगाताका स्वास्थ्यमञ्चनी नीतिगत व्यवस्थालाई कावांचयन गर्ने जनस्वास्थ्य सेवा ऐन, वि.सं. २०५४, सेताल लागू गरिएको छ ।

लामासम्म गरिएका प्रयोगहरूबाट स्वास्थ्य लेत्रमा केही उल्लेख प्रयोगिहरू भएकालाई बनुपने कामकाज जाई देउने छन् । स्वास्थ्य सेवामा देखिएका भौगोलिक, गणराजिक, सामाजिक, आर्थिक, साम्बन्धिक र वैज्ञानिक जस्तामानताहरूलाई कम गरी स्वास्थ्य प्रयोगमीलाई सुझाउ गर्दै जनालाई गुरुसम्मीलिय सेवा देखान गर्नु आवश्यक छ । यसका लागि यह जनशालाको महाविषय भूमिका राखेको हुन्छ । सौमि नायरिकाकामा लागि सामाजिक न्याय र सुधारनमाना आधारित सळम स्वास्थ्य प्रयोगीको विकास र विस्तार

66

हालस्तरमा जारिएका प्रयोगहरूलाई स्वास्थ्य लेत्रमा केही उल्लेख प्रयोगिहरू भएकालाई बनुपने कामकाज जाई देउने छन् । स्वास्थ्य सेवामा देखिएका भौगोलिक, गणराजिक, सामाजिक, आर्थिक, साम्बन्धिक र वैज्ञानिक जस्तामानताहरूलाई कम गरी स्वास्थ्य प्रयोगमीलाई सुझाउ गर्दै जनालाई गुरुसम्मीलिय सेवा देखान गर्नु आवश्यक छ । यसका लागि यह जनशालाको महाविषय भूमिका राखेको हुन्छ । सौमि नायरिकाकामा लागि सामाजिक न्याय र सुधारनमाना आधारित सळम स्वास्थ्य प्रयोगीको विकास र विस्तार

99

ગવે ગુણમલીય સ્વાસ્થ્ય સેવામા પણું ર ઉપરોગ મુનિશિકત ગર્ને પણ જાહેરી છે । બસકા લાર્ગ સૈફી સરોકારાણાહારકા ચીચ પ્રાણવકારી સમનવય ર સહકારેસાઈ વધ સુદૃઢ ગન્યને આવશ્યકત છે ।

સન. ૧૦૭૮ મા 'જાના આટા'ના સમનવય વિશવ સમેસનાબાટ પ્રાચીનીક સ્વાસ્થ્ય સેવાકો વિશવકારી અભિવયન ર દિલો વિકાસ નાચ લગાયતક બનાતાંદ્રિય પ્રાણવદ્વાહારને સ્વાસ્થ્યમા સર્વાચારી પણું બડાઉન મહાયાપૂર્ણ યોગદાન પુન્યાએ છેનું । સ્વાસ્થ્ય પ્રાચીની સુદૃઢ ગવે સ્વાચીય તહમા ગુણમલીય પ્રાચીનીક સ્વાસ્થ્ય સેવાકો પણું વિશવકાર ગર્ને વિશવકારી અભિવયસાઈ વિશવનાલ દિન વિનિયો રાજનીશિક નેતૃત્વ સમેત આવશ્યક છે ।

અહી કંસ વિકીસત દેશહારના મહિલા ર વાલબાનિકાહારની સ્વાસ્થ્ય કરી રાખી ર સેવનશીલ દેખિન્દુ । નેપાલની જનમંદ્યા તથા સ્વાસ્થ્ય સર્વેક્ષણ, સન. ૨૦૭૫ અનુસાર લાંચ વર્ષમનિકા વાલબાનિકાઓ સુધૂરૂપ પુલિહાજાર જીવિત જનમાણ ૨૫ રોકો છે । ત્યારેણી પુલિશાળ જીવિત જનમાણ ૨૫, માત્રમણું હુને ગરેકો છે । પોષણકો અભિવા હોણો પાંચ વર્ષમનિકા ૨૫ પુલિશાળ વાલબાનિકામા પુદ્ધોપન દેખિન્દુ । ઉત્તાંતાનુસાર જીસ નવુંદે ર સ્થાનાંદે ભાગ્યકારી વાલબાનિકા ૧૦ પુલિશાળ છેનું । ડરેનાંતાનુસાર હુન્યને જન્યા કંસ તૌલ ભાએ ૨૫ પુલિશાળ વાલબાનિકા રોકો છેનું । નેપાલની રોગાલ્યાધિકો ભારતસ્વભાવી પુતીબેન (સન. ૨૦૭૫) અનુસાર નેપાલમા સ્પૃષ્ટીકો પ્રમબૂ કારણકા કરપણ નસને રોગાળ છેનું । કુસ માયુસાંગે રોગવકાટ હુને માત્ર ૫૫ પુલિશાળ, પીટપટકાટ ૯, પુલિશાળ ર ચાંકી ૨૫, પુલિશાળ સુરકા રોગ, માત્ર, નવજાત તથા પોષણસર્વની રોગહારકાટ હુને ગરેકો તથાઙું છે ।

વિશવકારીકરણ, બનાઈસરાઇ ર શહેરીકરણસરી શાનધાર ર જીવનાંદીની આએકો પરિવર્તનને સર્વે ર નસને રોગહાર પદ્ધતે ગાએકા છેનું । વધુદી માનિશક સ્વાસ્થ્ય સર્વના, ચાચ અસુરકા ર ચાકુંલિક વિષદાને જનમંદ્યા વધ ચુનીલીપુંઝ વન્દી નાએકો છે । જાનાચાય પરિવર્તન ર વસ્તુને સ્વાસ્થ્યમા પણે નકારાતાંક પ્રભાવહારનાઈ ન્યૂનીકરણ ગર્ને રાંદ્રિયવનારા તરફાનું ચહેરા મન્યાંદે દેખિન્દુ । યો સન્દર્ભમા નાચી રાંદ્રિય

સ્વાસ્થ્ય રાજીનિસિસે જનમાયુ ચરિકતન, જનમંદ્યા વિશવસ્થાપન, બાંધકારી સ્વાસ્થ્ય, સાચાંશિક મરણાળ, સ્વાસ્થ્ય પુણાદીકો સુદૃઢીકરણમસ્તા મહાયાપૂર્ણ સાચાનહકારનાઈ સમુદ્ધન ગર્નેક લાર્ગ પુસ્તા ર સમજતામા જાડારિત યોજના તર્જુમા, કાંચાંનવયન ર અનુગમનાસાઈ પ્રાચીમિકતામા રાખન્યાં । યસને સ્વાસ્થ્ય સેવામા સમતામૂલક પણું બડાઉન ઉસેસ્થ્ય યોગદાન ગર્દેછું ।

યથાર્થમા, સ્વાસ્થ્યમા હુને વિહિતન સ્વાર્થ પણ તલ્લ રોકો છે । સ્વાસ્થ્ય સેવાકો પણું ર ઉપરોગમા ડાંની ર ગરીબચીચ હેરે અનુમાનના છે । અધીર્થીને જનતાને અંદેશ ગરેનુંનાર ગુણમલીય સ્વાસ્થ્ય સેવામા સહજ પણું છેનું । અંદેશાર્થ સ્વાસ્થ્ય સેવામા નગારીનુંકુપ પ્રાણફાન જ્ઞાન ગર્ને કાંઠિન ચુનીલીક છેનું । સ્વાસ્થ્ય સંયાહરકા આધુનિક ઉપકરણ ર દાખ જનગલિકો ઉપલબ્ધતા, મુજના પ્રાણાંકો પ્રભાવકારી વ્યવસ્થાપન, સાંભળિતામૂલક બનુંસત ર મન્યાંદુન એથું બુની રીતદ્વાર તથા આધુંલી વ્યવસ્થાપન પ્રાણી સુનિશ્ચિત ગર્ને સ્ક્રિપ્ટો હૈનું । યસકો પ્રભાવ શાનદારી દર્શાવ કેશક સ્વાસ્થ્ય સંસ્પા ર સમુદ્ધાપન વાંદી દેખિન્દુ ।

શી ચુનીલીહસ્તનાઈ સામના ગર્ને સ્વાસ્થ્યનાઈ ઉલ્લ પ્રાચીમકાતામા ગર્ભી ગાંધીય વર્ટ્યુન સ્વાસ્થ્યકો જેણ બડાઉંડે સૈગાનુ પણું । યો

સન્દર્ભમા ગાંધીય સ્વાસ્થ્ય વિલ રાજીનિત (વિ. નં. ૨૦૭૩-૨૦૮૦) ને સ્વાસ્થ્ય કેશક આવશ્યક નગારીનાઈ વધ પારદર્શકી ર નાગત પ્રભાવકારી વનાઉન જોડ દેખિએ છે । તર, સ્વાસ્થ્યમા નગારી બડાઉંડે સ્વાસ્થ્ય-વીના માર્કેત સ્વાસ્થ્ય ઉપકારણ નાલિકાંકો પણું સુનિશ્ચિત ગર્ને રાજીનિસિ પ્રભાવકારી કાંચાંનવય સ્વાસ્થ્ય સમસ્યાહારકો પ્રભાવકારી રોકાણ ર પુતીલાંકા લાનિ પુરેશ ર સ્વાર્થીય તહમા લાંબી સરોકારવાલાહારકો લાના, સમનવય ર સહકાર્ય બડાઉંડે સૌત પરિચાસનમા વિશે જોડ દિનુંને દેખિન્દુ ।

નહ, પુરેશ ર સ્વાર્થીય તહમા લાંબી સરોકાર્ય સ્વાસ્થ્ય કેશકો નગારીમા સમનવય કાંચાંન ગરી જીવનોંિક, સામાંજિક, અધિક, માસ્ટ્રીલિક તથા નૈફિક વિશિષ્ટતામાઈ સરેત માયનગર ગર્દે સોાંકો સમતામૂલક ર ન્યાયોધિત વિશે સુનિશ્ચિત ગર્નિનુ પણું । સ્વાસ્થ્યમા અંદેશાં પ્રાણફાન જ્ઞાન ગર્નેક લાર્ગ લાગા પ્રભાવકારિતામા

आजारित दृष्टगते भगवानी गर्नु आवश्यक छ । हामलाम प्राप्त गरेका उच्चस्थितिहालनाई निरन्तरता दिई स्वास्थ्य क्षेत्रमा प्राप्त अन्तर्गतिट्ट्यु भगवानी, स्वास्थ्य र महाकार्यालय अङ्ग बही चारदीमी र प्राप्तवाक्यरी बनाउन सहार्भागितामूलक अनुगमन तथा सभीका हुनु पर्दछ ।

किरीय रघनीतिको मर्मान्तमार स्वास्थ्य क्षेत्रको किरीय यात्रा यात्राउन महारी, प्रदेश र स्वास्थ्य तहको बजेटमा कल्पीमा १० जीतिशत रकम स्वास्थ्य क्षेत्रमा भगवानी गर्ने, स्वास्थ्यमा सार्वजनिक-निजी साकेतदारी अवधारणालाई प्राप्तवाक्यरी कार्यान्वयन गर्ने र आवश्यक मागत प्रतिक्रिया विश्वेषणको अज्ञानमा कार्यकारको दृष्टि, प्राप्तवाक्यकरण गर्ने कार्यकीति अपनाइनु पर्दै । अकोतार्क, स्वास्थ्यमा सार्वजनिकी पर्दै र सुनिश्चित गर्ने विश्ववापी मान्यतालाई व्यवहारमा भाग्य गर्ने स्वास्थ्यसञ्चयनी पर्याप्त जनशक्ति आवश्यक हुन्दै । वस्तो जनशक्तिको उत्पादन र वितरण दर्दी स्वास्थ्य सेवाको पर्दै नपुऱ्योग भएरी क्षेत्रमा गरिय, अनुगमन र सीमानाकृत समुदायहालनाई प्राचीनकालमा राख्नुपर्दै ।

सहार्भागिता भाग भएर्थाई स्वास्थ्यीय र प्रदेश सरकारहाले स्वास्थ्य सेवा भगवाकल ममाकिक सेवाको महत्वपूर्ण जिम्मेवारी बहन गर्न थालेका छन् । अहिसे स्वास्थ्य सेवाको विस्तार र अङ्गको मान्यताम स्वास्थ्यीय तहका बढा र मनुष्याप्रमाण पुरेको छ । यसले गर्न भवै तहमा स्वास्थ्यसेवाको जिम्मेवारी र मेल्कूम उपलब्ध छ । स्वास्थ्य क्षेत्रमा हुने भगवानी कल्पना बढाई गएको अवस्थामा प्रतिकारनालक तथा उपचारालक स्वास्थ्य सेवाका सामिं आवश्यक जनशक्ति उत्पादन, व्यवस्थापन र उपयोग पनि बढाएको देखिन्दू । सहार्भागिता संवर्धनानुरूप दृष्टि तथा युक्तारीय स्वास्थ्यसञ्चयनी जनशक्तिको उपलब्धता र समाजमूलक वितरण गर्ने उद्देश्यले तयार पारिएको स्वास्थ्य जनशक्तिसञ्चयनी गरिदृष्टि रघनीति (वि.स. २०७३/८०-२०८५/८६) को प्राप्तवाक्यरी कार्यान्वयन गर्ने बलको आवश्यक समीला गर्नु जर्नी छ ।

स्वास्थ्यीय तहको अधिकार कार्यान्वयन गर्ने सहाय, प्रदेश र स्वास्थ्यीय तहकीय समन्वय र महाकार्य प्रवर्द्धन गर्ने गुणसारीय सेवा प्रदान गर्ने स्वास्थ्यीय सरकार सञ्जालन ऐन, वि.स. २०७४ भाग भएको छ । सर्वांत अनुदान मार्केट हस्तान्तरण गरिएका प्रदेश र स्वास्थ्यीयसरकार स्वास्थ्य कार्यकारकहालको प्राप्तवाक्यरी योजना लज्जामा, कार्यान्वयन, अनुगमन र मन्त्रालयम गर्ने समन्वय र पुऱ्योगीलाई वप सुदूर बनाउनु जर्नी छ । गरिदृष्टि स्वास्थ्य

नीति, रघनीति र विभिन्न निर्देशकाहरूको स्वास्थ्यकरणका प्रयत्नसङ्कलनाई सम्पादन गर्ने सर्वांगीनी स्वास्थ्य चौंचका महत्वपूर्ण सूचकहरूको मापन, अनुगमन र समीक्षा गर्नु आवश्यक भइसकेको छ ।

संस्कृत र साहित्यकारी विवरण विवरण विवरण ४

हाम्रो अनुरोध

लेपानको दिग्गोपला अठिवृद्धि र प्रगतिको लाभि विभिन्न व्याप्ति र संस्थाहरूबाट गर्नुगाएको सहयोगको कदर गर्दै अन्य संस्था एवं गर्नु गर्नुपर्दै पनि लेपानको अक्षय कोषका लाभि सरदो सहयोग गर्नुहुन र आफ्नो पर्दै अधिकारी लेपानको उद्देश्यसँग गेलखाने संस्थाहरूलाई लेपानको अक्षयकोषबाटे जालकारी गराई कोष प्रवर्द्धनगा योगदान पुऱ्याउनुहुन त्यार्दैको अनुरोध गर्दछौ ।

कार्यकारिणी समिति
लेपान सहमानीमूलक कार्य समूह (लेपान)